usiness

IIFL Home Finance commits Rs 2 crore for Covid support

New Delhi,

IIFL Home Finance, one of India's leading housing finance companies has committed to raise Rs 2 crore to support COVID patients, their families and healthcare workers across India.

They have initiated a fund-raising campaign on GiveIndia platform for this purpose. The funds will be used for providing oxygen supply and life-saving equipment, help low-income families bereaved by COVID, overcome their loss, provide cooked food and ration kits and help with isolation facilities and medical care to COVID patients.

The Rs 2 crore fund will be shared with Give India, SOS Children's Village of India, Rise Against Hunger India and Doctors For You. The contributions are expected by customers, employees, and the general public.

Commenting on the development Mr Monu Ratra, CEO, IIFL Home Finance said, "Due to a spike in cases across the nation, Covid-19

has led to a lot of challenges for everyone and has affected many people throughout the country. We, IIFL Home Finance Ltd., are coming together with Givelndia to raise funds to support the country in this time of need."

GiveIndia and Doctors For You will use the funds for COVID care centres and oxygen supply, Rise Against Hunger India will use the funds for ration kits and cooked meals, and SOS Children's Village of India will use the funds for child care. IIFL Home Finance is a part of the diversified nonbanking finance company IIFL Finance, which caters to the credit needs of the unbanked underbanked population of

India present across 2500 locations with a client base of over 60 lacs.

IIFL Home Finance calls out to the nation to come together during these tough times and contribute their share for the cause at iifl-hfl.giveindia.org

Offshore staffing firm Entigrity announces Covid-19 bereavement support with one year salary

Keeping the employees welfare as the top priority, Entigrity, a leading offshore staffing company, announced a new COVID Support Policy for its employees. Under the new policy, the offshore staffing company will give twelve months salary to the families of employees who have lost the battle to COVID.

The company will also provide children education support up to graduation level. Entigrity is a leading offshore staffing solutions provider to major accounting and tax firms situated across North America. Headquartered in Sugar Land, TX, Entigrity has five offshore offices located in India; three of them in Ahmedabad and one each in Mumbai and Vadodara.

Putting more light on the new policy, Shalin Parikh, President and CEO, Entigrity Group, said, "Our employees are our assets and their wellbeing is our topmost priority.

Food & Grocery segment. E-grocery has been one

of the fastest growing seg-

ments in the consumer e-

commerce space and its

growth is propelled with

India's rising consumption

and digital penetration. The

current pandemic has fur-

ther accelerated its adop-

tion as consumers seek the

convenience of ordering

quality groceries delivered safely at home.

2011 in Bangalore and has expanded its presence to 25+cit-

ies across India since then. In

the e-grocery space, BigBasket

provides one of the largest as-

sortments (50,000+ SKUs) and

provides customers the conve-

nience of home deliveries on

preferred dates and timeslots.

It also operates a farm-to-fork

supply chain with over [12,000]

farmers and several collection

centers across India to deliver

high quality & fresh fruits and

vegetables to its customers.

Pratik Pal, CEO of Tata Digital

said: "Grocery is one of the larg-

NOTICE N.o DUBA/Cons/434/MR/2021-

(122) Dated: 25/05/2021 Mr. Amit

S/o Chandur Jethanand Bhatia,

Resident of Behind New Watch

Co Nr. Patharia, Building Sorabji

Compound, Juna Wadej

Ahmedabad. 380013, India

Present Address Apt 705, Emerald

Bldg, Mankhool, Dubai UAE. And

Miss. Priyal Prashant Adhiya

Daughter Of Prashant Kirti Adhiya

Resident Of Bldg. No. 9, A-101

Ketynagar, Dahanu Road, Thane

Pin: 401602, Maharashtra, India

Present, Address: ABC Arabian

Suits A, Block-APT 203, AL Raffa

Bur Dubai, UAE. Above Mention

Indian National are presently

residing in UAE. Have given notice

of intended marriage between them

Under the Foreign Marriages Act 1969. If any one has objection to the

proposed marriage he/she should

file the same with the undersigned

according to the procedure laid

down under the act/ rules within

thirty days from the date of

publication of this notice. Jitendra

Singh Negi) Marriage Officer)

Cousulate General of India, P.O

Box 737, Dubai, UAE, Fax. No

cons1.dubai@mea.gov.in.

cons3dubai@mea.gov.in.

Homepage: www.cgidubai.gov.in

0097143970453. Email

BigBasket was founded in

Our new COVID Support Policy is a reflection of our commitment towards them. Iles. Seeing the oxygen shortage for patients, the offshore staffing firm is also Entigrityhad launched a

planning to buy oxygen concentrators for the em-With the new policy we extend our support to our employees and their families. ployee and we hope that it Entigrity is working on a would work as a relief for the bereaved family members in the time of grief and uncer-

plan to start post COVID health counselling, especially for mental wellbeing. The company has set up an in-house gym and recreation area to motivate people to adopt a healthy lifestyle and stay fit. Being a socially responsible entity,

Food Distribution Drive to support the underprivileged sections of the society in April 2020. Since then the company has been supporting the families of construction workers, contract workers, street sellers, rickshaw drivers, cart pullers, labourers, etc by distributing food and ration. Recently, the company extended its support to the victims of Tauktae cyclone under its food distribution drive.

realme brings X7 Max 5G, next-gen Smart TV 4K to India

Fastest-growing smartphone brand realme on Monday introduced X7 Max 5G with first MediaTek Dimensity 1200 5G chip in India, along with Smart TV 4K that aims to provide an all-round package with the 4K cinematic experience.

tainty." In order to support

its people amid second

wave of COVID-19, Entigrity

is taking care of the hospital-

ization expense through a

group Mediclaim policy for

all employee and their fami-

Featuring a 120Hz Super AMOLED display for smooth gaming, 50W SuperDart Charge with a 4500mAh battery and a Sony 64MP triple rear sensor, the 6.43inch X7 Max 5G will be available in two variants --8GB+128GB for Rs 26,999 and 12GB+256GB at Rs

The realme Smart TV 4K with with Dolby Vision HDR technology and Dolby Atmos immersive audio powerful quad-core processor is priced at Rs 27,999 (43inch) and Rs 39,999 (50inch). All the devices will be up for sale on June 4 from 12 noon onward on Flipkart.com, realme.com and mainline channels, the

company said in a statement. "realme's aims to provide its customers with the best tech-lifestyle experience possible, and the launch of both these products is another step in that direction," said Madhav Sheth, Vice President, realme and CEO, realme In-

dia and Europe. "realme Śmart TV 4K reaffirms our commitment to bring the next generation technology to our customers and highlights our strong presence in the Smart TV segment," he

realme X7 Max 5G comes with dual 5G standby. It will come in three colours --Mercury Silver, Asteroid Black and Milky Way. With 50W SuperDart Charge, the smartphone can be fully charged 50 per cent in ap-proximately 16 minutes, claimed the company.

The device has a Sony

64MP triple camera with super nightscape at the real and a 16MP wide-angle selfie camera.

realme Smart TV 4K offers a LED screen, Google hands-free voice control, powerful 64-bit MediaTek quad-core processor, ultra bezel-less design and TUV Rheinland Low blue light certification

CHANGE OF NAME

have changed my name from VALLI ARUN to new name KARPAGAVALLI ARUNPRAKASH

Add.: T-106, Shrinandnagar 2, Vejalpur, Ahmedabad-51

Tata Digital logs into Big Basket quired a majority stake in Supermarket Grocery Supe-commerce player in the

Mumbai,

Tata Digital Limited, a 100% subsidiary of Tata Sons Private Limited has ac-

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

ELECTRIC WORK AT SABARMATI

DIVISIONAL RAILWAY HOSPITAL

E-Tender Notice No. Sr.DEE/ADI/07 (21-22). dtd. 27.05.2021. **Tender No.** EL

50-1-ADI-T-09-2021-22 (1) Name of Work: Electrical work in connection with

Up gradation of Operation theatre and

Intensive Care Unit at Divisional Railway
Hospital-Sabarmati (2) Estimated cost

₹ 35,39,693.66/- (3) EMD: NIL (4) Date

and Time of Submission and opening
Not later than 15:00 Hrs of 25-06-2021

and 25-06-2021 at 15:30 Hrs. (5 Address of the office and Website

details: Sr. Divisional Electrical Engineer, D.R.M. Office (W.R.), Nr. Chamunda Bridge, Opp. G.C.S. Hospital,

Naroda Road, Amdupura, Ahmedabad 382345. Website: **www.ireps.gov.in**

plies Private Limited (BigBasket) – India's largest

PUBLIC NOTICE

This is to inform all broadband subscribers of Vision Smartlink Networking Private Limited that our broadband and internet connectivity services will be discontinued w.e.f. 01.06.2021 as we shall cease to provide our services.



504. Indraprasth Corporate, Opp. Shell Petrol Pump, Prahalad Nagar, Ahmedabad. Phone: (079) 66219000

Follow us on: twitter.com/WesternRly

Seta Chemicals Plot No. 631-639, 654-656, 2019-2027/4, GIDC, Panoli, Ta. - Ankleshwar Dist.- Bharuch Gujarat

Environment Clearance

It is hereby informed that the state level Environment impact Assessment Authority, Gandhinagar, Gujarat has accorded the Environment Clearance for Setting up of the proposed manufacturing SYNTHETIC ORGANIC CHEMICALS by M/s. SETA CHEMICALS Plot No. 631-639, 654-656, 2019-2027/4 GIDC, Panoli. Dist.-Ankleshwar Dist.- Bharuch Gujarat - vide FILE NO.: SEIAA/GUJ/EC/5/f)/1432/2020 Dated 3th DECEMBER, 2020.

A copy of the clearance letter is placed at Office of Gujarat Pollution Control Board (Ankleshwar & Gandhinagar) and may also be seen at website of state level Environment impact Assessment Authority, Gandhinagar, Guajrat at http://seiaa.Gujarat.gov.in/

Date: 15.12.2020

Proprietor Seta Chemicals



GUJARAT MINERAL DEVELOPMENT e-Tender Notice- 1/ULP/ARC/CIVIL

MAINTENANCE WORK/2021 (Re invite) e-tenders are invited for "Annual Maintenance Contract for

Two years for the miscellaneous Civil works (Repairs & Maintenance work as and when required) at GMDC mines premises, at Lignite Project Umarsar Tal: Lakhpat, Dist- Kutchh,

For e-tenders notice, tender documents and for further details visit our website www.gmdcltd.com. Tender shall be downloaded from http:gmdc.nprocure.com

and submitted on line as per e-tender notice. Please visit http: gmdc.nprocure.com for time to time for any corrigendum /

No. INF/ABD/233/20-21



Water And Sanitation Management Organization WASMO-BOTAD TENDER NOTICE NO.- 02 / 2021-22

Unit Manager, District Water & Sanitation Unit Botad, Block No. 9, Yoginagar, Near New Circuit house, Paliyad Road, Botad-364710, invites Tender of below mentioned work by E-Tendering on-line system Name of work: Construction of R.C.C. U/G Sump 7.00 lakh lit. capacity. Pump or work: Construction of R.C.C. Ord Sump 7.00 lakn lit. capacity. Pump House, Pumping Machinery for sump, Providing, Supplying, Lowering, Laying & Jointing of PVC Distribution And Rising Main Pipeline, House Hold Tap Connection, VAP Board, Slogan writing works for TURKHA Village, Ta- Botad, Dist- Botad under "JAL JIVAN MISHION" Programme. Detailed information of Tender Log in to website http://nprocure.com & www.statetenders.com

a www.stateteriaers.com	
Event	Submission Date
On Line Tender ID No.	463666
Estimated Cost Rs.	Rs.01,32,82,417.11
Last Date On-line submission	Up to Dt: 17.06.2021 of 18:00 Hrs.
Tender Fee, EMD	Tender Fee Rs. 3600.00
	E.M.D. Rs.: 1,32,830.00
Registration of Contractor	C Class & above

For any query regarding water supply in rural area contact on GWSSB Toll free Helpline No. 1916.

DDI/BVN/127/21-22



Gujarat Water Supply & Sewerage Board

Tender Notice No:- 01, 02, 04 & 05 Year : 2021-22 Tender I.D. No:- 463730, 463734, 463744, 463746

Tenders are invited through Two bid E-Tendering by the Executive Engineer P.H.W. Dn. Surendranagar "Jal Bhavan" Near Circuit House, Rajkot Road, Surendranagar for (1) Const. of 12 meter hight & 100 lakh liters capacity ESR and L.L.J. of 140 mm. Dia. & 400 meter length PVC Pipelines at village Mota Ankevaliya Under the provisions of the 14th Finance Commission. (2) Providing Supplying and L.L.J. of 110 mm. Diameter PVC pipeline and construction of pump cabins near Nimaknagar village new Bor to existing pipe line Under M & R To NCD-4 R.W.S.S. (Group-8) (3) Operation, maintenance and regular Water Supply work for 29 village of Vadla & Dholidhaja Zone Under S-2 S-3 Regional Water Supply Scheme for 24 Month. (4) Repairing and Developing Work of Vithalgadh HW & WTP Under NCD-4 R.W.S.S. (Group-1) from the Government Registered Contractor. Tender documents can be seen, down-loaded and submitted on website https://www.nprocure.com. Last date of submission of Tender is Dt. 15.06.2021 up to 18:00 Hours. Physical submission of Tender Document is Dt. 16.06.2021 up to 15:00 Hours By Regd. Ad./ Speed Post / Hand Delivery Accepted. Any additional Information of the tender will be available at above mentioned office. All right is reserved to reject any or all tenders without assigning any reasons thereof. Any amendment regarding this tender will be shown

publishing only on website only. For any query related to village water supply scheme, contact on Toll Free No. 1916

માહિતી/સુરેન્દ્રનગર/૮૩/૨૧-૨૨

Executive Enginee

UNICK FIX-A-FORM & PRINTERS LTD

CIN: L25200GJ1993PLCO19158

PH NO. +91 9978931303/04/05 E-mail: info@unickfix-a-form.com Regd. Office: Block No.472, Tajpur Road, Changodar, Tal: Sanand, Ahmedabad-382213 **EXTRACT OF THE STANDALONE AUDITED RESULTS FOR** THE QUARTER AND FINANCIAL YEAR ENDED 31 ST MARCH,2021 (Rs. in Lacs)

					, , (//	J. III Luoj
		QUARTER ENDED	QUARTER ENDED	QUARTER ENDED	YEAR ENDED	YEAR ENDED
SR.		31.3.2021	31.3.2020	31.12.2020	31.3.2021	31.3.2020
IVO	TAKTIOULAKO	Audited	Audited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations (Net)	1392.94	1107.09	1322.66	5601.53	4841.21
2	Net Profit / (Loss) for the period before					
	tax and Exceptional items	56.40	32.23	14.71	310.00	394.63
3	Net Profit / (Loss) for the period before					
	tax and after Exceptional items	56.40	32.23	14.71	310.00	394.63
4	Net Profit for the period after Tax	42.31	16.83	11.03	232.51	288.63
	(after Extraordinary Items)					
5	Total Comprehensive					
	Income for the period	0.00	0.00	0.00	0.00	0.00
6	Equity Share Capital	548.50	548.50	548.50	548.50	548.50
7	Reserves(Excluding Revaluation					
	Reserves as at balance sheet date	0.00	0.00	0.00	1922.32	1689.81
8	Earning per Share-Basic					
	(after extraordinary items)					
	(of Rs. 10/- each)	0.77	0.31	0.20	4.24	5.26
	Earning per Share-Diluted					
	(after extraordinary items)	0.77	0.31	0.20	4.24	5.26
	(of Rs. 10/- each)					

Note:-

- (1). The above result is an extract of the detailed format of financial results for the quarter and year ended 31st March 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulation 2015. The full format of the Quarterly and yearly Financial Result as on 31st March 2021 is available on company website.
- The above audited Financial results for the quarter and year ended 31st March 2021 were reviewed by the Audit committee at their meeting held on 31st May 2021 and approved by the Board of Directors at their meeting held on 31st May 2021.
- The figures of the quarter ended 31st March 2021 and 31st March 2020 are the balancing figures between audited figures in respect of the full financial year and the published unaudited year to date figures upto fourth quarter of the respective financial years. Also the figures upto the end of the third Quarter were only reviewed and not subjected to audit.

BY ORDER OF THE BOARD FOR UNICK FIX-A-FORM & PRINTERS LTD Sd/- BhupenNavnit Vasa WHOLETIME DIRECTOR

Place: Ahmedabad Date: 31.05.2021

SAKAR HEALTHCARE LIMITED

[CIN: L24231GJ2004PLC043861]

Reg. Office: Block No.10-13, Village: Changodar, Sarkhej-Bavla Highway, Tal: Sanand, Dist: Ahmedabad – 382 213 Phone: 02717-250477 Fax: 02717-251621 Email: info@sakarhealthcare.com Web: www.sakarhealthcare.com

> **EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS** FOR THE QUARTER/YEAR ENDED ON 31ST MARCH

DIN: 00150717

FOR THE QUARTER/ YEAR ENDED ON 31ST MARCH, 2021 Rs. In Lak						
		Standalone	Consolidated			
PARTICULARS	Quarter ended on 31-03-2021	Year ended on 31-03-2021	Quarter ended on 31-03-2020	Quarter ended on 31-03-2021	Year ended on 31-03-2021	
	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	
Total income from operations (Net)	2,168.15	9,473.93	1,826.04	2,168.15	9,473.93	
Net Profit for the period (before Tax,						
Exceptional and/or Extraordinary items)	223.61	1,324.22	307.44	222.66	1,323.27	
Net Profit for the period before tax						
(after Exceptional and/or Extraordinary items)	223.61	1,324.22	307.44	222.66	1,323.27	
Net Profit for the period after tax						
(after Exceptional and/or Extraordinary items)	174.39	1,069.20	286.17	173.43	1,068.25	
Total Comprehensive Income for the period	182.19	1,073.84	281.96	181.22	1,072.89	
Equity Share Capital	1,561.80	1,561.80	1,496.10	1,561.80	1,561.80	
Reserves (Excluding Revaluation Reserves)	-	8,284.37	-	-	8,283.42	
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)						
Basic:	1.17	6.88	1.88	1.17	6.87	
Diluted:	1.17	6.88	1.88	1.17	6.87	
NOTES:	·					

Date:

31st May, 2021

- The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.
- The full format of Annual Financial Results are available on the website of NSE at www.nseindia.com and also on the website of the Company i.e. www.sakarhealthcare.com.

For SAKAR HEALTHCARE LIMITED Sd/- SANJAY S. SHAH MANAGING DIRECTOR (DIN: 01515296)

Business Brief III

AM/NS India continues vaccination for its employees

In their continued effort to ensure the health and safety of its employees, their families and business associates, Arcelor Mittal Nippon Steel India (AM/NS India) has privately procured 33,000 doses of Covid-19 vaccines. The ordered vaccines were from Serum Institute of India, the manufacturer of Covishield, and will be administered to those in the age group of 18 years and above.

This batch of vaccines will be shared with all operational locations of AM/NS India. All locations will follow the directive of their respective local state governments for vaccination.

The priority of AM/NS India in a pandemic like this is to ensure the safety and health of our employees, their dear ones and our business associates, aiming for 100% vaccination for all. We re-main committed to their well-being and will provide it free of cost across locations of our op-erations." said Anil Matoo, Head - HR operations, İR & Administration, AM/NS India. The drive has kick started Pan India at all AM/NS India facilities. The entire vaccination drive is ex-pected to continue for a week. The undertakenvaccination drive for sure will take off thepartial load from the government.

Sintercom continues the growth trajectory, revenue up

Ahmedabad:

Sintercom India Ltd. one of the leading automotive sintered components manufacturer continue to show growth even with the auto industry shows negative trends.

Revenue from operations for the quarter ended March 2021 grew from 10.61 crore in March 2020 to 17.86 crore in March 2021 marking a strong growth of about 68% over previous quarter. The company was also able to curtail the net losses as the net loss was at Rs. 2.37 lacs in March 2021 as against a loss of Rs. 2.19 crore in March 2020. The strong growth for the quarter reflects the robust demand for the products in the March quarter.

Commenting on the financial performance of the company Mr. Jignesh Raval, Member of Board & Managing Director, SINTERCOM India Limited, said, "The ongoing pandemic had major and wide-ranging impact on the auto sector and our primary focus was the safety of our workforce who walked the miles for us to ensure continuity of business.

Vandita Kaul appointed as nominee director of Bol

Ms. Vandita Kaul, Additional Secretary, Ministry of Finance, Department of Financial Services, Government of India has been appointed as nominee director of Bank of India by the Government of India. The bank received the communication from the Finance Ministry about Ms. Kaul's nomination.

Ms. Vandita Kaul holds M.Sc degree in Zoology from the University of Delhi and a Diploma in Systems Management from NIIT. She has been appointed by Government of India as Government Nominee Director of the Bank, with immediate effect and until further orders. Presently she has been posted as Additional Secretary, Department of Financial Services, Ministry of Finance, Government

Samsung ups presence in Europe, Middle East, Africa in Q1

Samsung expanded its presence in the Europe,

Middle East and Africa (EMEA) smartphone market in the first quarter of the year, a report showed on Monday. The South Korean tech giant shipped 30.6 million smartphones in the EMEA market in the January-March period for a 32.8 percent market share, according to the latest report industry researcher Interfrom national Data Corp.

(IDC). The figures were up from a earlier year when the company shipped 22.7 million smartphones for a 29.5

percent market share. 'Samsung had a very strong quarter and captured nearly two-fifths of the European smartphone market -- its largest quarterly share for six years," IDC said. Xiaomi moved up two spots to také the runner-up position after its smartphone shipments nearly doubled to 14.4 million units in the first quarter for a 15.4 percent market share. Its Chinese rival, Shenzhen Transsion Holdings, came in third with a 15 percent market share by shipping 14 million smartphones in the first three months of 2021, reports Yonhap news agency. Apple fell from the second spot to fourth place with a market share of 14.3 percent after shipping 13.3 million iPhones in the first quarter.

IFC plans to lend \$50M for **Rabobank India**

Chennai,

International Finance Corporation (IFC) part of the World Bank group plans to lend up to \$50 million to Rabobank India, the Indian branch of Netherlands-based Rabobank. According to IFC, the loan will be of five year tenor and it aims to support Rabobank India's efforts to expand its lending programme to climate smart agriculture (CSA) and renewable energy projects. The IFC and Rabobank India are also in discussions on the former's advisory services aiming to assist the latter in strengthening its internal knowledge of selected agriculture value chain players in some geographies in India as well as the design of lending products needed to finance CSA solutions. The Netherlands based Rabobank is a major in

retail banking and in the food and agri business markets worldwide. It has one branch in India in Mumbai. Rabobank India deals with international wholesale banking activities with Indian clients as well as Dutch clients operating in India.

Nifty at record high, crosses 15,500 for the first time

Mumbai, The Nifty50 on the National Stock Exchange re-

corded a new high on Monday as it crossed the 15,500 mark for the first time in its history. It touched a record high of 15,508.50.

Around 10.56 p.m., Nifty was trading at 15,507.10, higher by 71.45 points or 0.46 per cent from its previous close. The BSE Sensex was trading at 51,727.69, higher by 304.81 points or 0.59 per cent from its previous close. It opened at 51,476.22 and has touched an intra-day high of 51,731.60 and a low of 51,179.94 points. Healthy buying was witnessed in oil and gas and energy stocks.

જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીને રામભાઈ ૯૦,૦૦૦ પરિવારોને આપશે વીમા સુરક્ષા કવચ ભારતની કુરિયર ઈન્ડસ્ટ્રીઝમાં વીમાનું પ્રિમિયમ માનનીય સાંસદ શ્રી દેશની જનતાને મદદરૂપ થવા માટે ત્રિમ સ્થાન ધરાવતા અને હાલ રામભાઈ મોક્રીયા દ્વારા ભરી રામભાઈએ શ્રી મૂારૂતિ કુરિયર

અગ્રીમ સ્થાન ધરાવતા અર્ને હાલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એવા શ્રી રામભાઈ મોકરીયાનો પહેલી જૂને ૬૫મો જન્મદિવસ છે. બ્રહ્મસમાજના અગ્રણી, કર્મયોગી અને સમાજસેવા માટે હંમેશા કાર્યરત એવા રામભાઈ કોરોનાકાળમાં પણ જનસેવામાં વ્યસ્ત છે. પોતાના જન્મદિવસની ઊજવણી કરવાના બદલે તેમણે અનોખી પહેલ હાથ ધરી છે જે અંતર્ગત તેઓ પોરબંદર જિલ્લાના ૯૦,૦૦૦ પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનું સુરક્ષા કવચ પૂરું પાડશે.

... આજના કોરોનાના કપરાકાળમાં દેશ અને દુનિયાના લોકો ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તેની સાથોસાથ અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. અચાનુક સર્જાતા અકસ્માતોના લીધે જ્યારે પરિવારના મોભી અથવા કમાનાર મુખ્ય વ્યક્તિનું निधन थाय त्यारे परिवारना अन्य સભ્યો આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે તેથી આવા કુટુંબોને મદદરૂપ બનવા અને પોરબંદર જિલ્લાના તમામ પરિવારોને વીમા યોજનાનું સુરક્ષા કવચ આપવાનું ₋ભગીરથ કાર્ય માનનીય સાંસદશ્રી રામભાઈ મોકરીયા હાથ ધરશે.

પોરબંદર જિલ્લામાં અંદાજે ૯૦,૦૦૦ પરિવારો વસવાટ કરે છે. આથી આ તમામ કુટુંબના પરિવારદીઠ એક સભ્યનું અકસ્માત વીમો - પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ આવરી લઈને ર્તેમના

કોરોનાકાળ વચ્ચે મહાકાલની

નગરી ઉજ્જૈનથી એક ચોંકાવનારો

વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં

કેટલાક લોકો એક વ્યક્તિને માર

મારી અધમૂરો કરી દે છે. તે અધમૂરો

થયા બાદ પણ તેના પર લાકડીઓથી

સતત હુમલો કરવામાં આવી રહ્યો

છે. યુવાનને ગુંભીર હાલતમાં

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

હોાસ્પટલના લઇ કવાના ગાંચ્યા છે, જ્યાં તેનું મોત નીપજ્યું છે. વીડિયોના આધારે પોલીસ આરોપીનીશોધ કરીરહીછે. મળતી

માહિતી મુજબ, આ ઘટના

જિલ્લાના લવકુશનગરની છે. અહીં પશુપાલનના વિવાદમાં એક યુવકની

નિર્દેયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓની નિર્દયતાનો

વીડિયો સામે આવતાની સાથે જ

સનસનાટી મચી ગઈ હતી.

એડિશનલ એસપી અમરેન્દ્રસિંહે

જણાવ્યું હતું કે, સંત બાલીનાથ

નગરમાં રહેતા ૨૬ વર્ષીય

ગોવિંદના પિતા રાજેશ લખવાલ પર

શુક્રવારે લવકુશ નગરમાં રહેતા

લાલા ભાટ, વિશાલ ભાટ, સાગર

ભાટ આહિટ અને અન્ય સાથીઓએ

'યોગક્ષને આખા વિશ્વમાં

પહોચાડવા માટે ૨૧ જુનને

'આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસક્ષ

તરીકે ઘોષીત કરાવવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર રચિત ગુજરાત

રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપવા ૧

સમગ્ર રાજયમાં જન જન સુધી

યોગનો પ્રચાર પ્રસાર થાય અને

લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો

સ્વાસ્થ્ય સુધારો કરવાનો આ

પર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન.ચેરમેનશ્રી યોગસેવક

શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ, ગુજરાત ભરના સમુદાયો અને

પરિવારોમાં યોગની શક્તિઓ

ફેલાવવા માટે આ મેગા કેમ્પેઇન

''હવે તો બસ એક જ વાત, યોગમય

બને ગુજરાત× અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પેઇન દરમિયાન યોગ સાધના થી ઇમ્યુનીટી વધારવા માટે યોગ, સૂર્યનમસ્કાર, શ્વસનતંત્ર / ફેફસા ને

વેસ્ટર્ન ટાઇમ્સ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી

-જાહેરખબર મેનેજર

પશ્ચિમ રેલવે – રાજકોટ ડિવિઝન

ઓક્યુપેન્સી સેન્સર ની જોગવાઈ

નિર્ણય લેવો.

આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ઝુંબેશનો હેતુ છે.

આપવામાં આવશે.

રામભાઈ જ્યારે પણ મળે ત્યારે એમના ચહેરા પર સ્મિત હોય છે. એ જ્યારે જેને પણ મળે, જેમની સાથે શેકહેન્ડ કરે એમને પણ એનર્જેટિક કરી દે છે. જીવનમાં પોઝિટિવ વલણ, વર્તન અને વાણી હોય. કામ કરવાની નિષ્ઠા હોય, ઈશ્વરમાં અપાર શ્રદ્ધા

રાજ્યસભાના સાંસદ અને શ્રી મારૂતિ ક્રિરયર સર્વિસીઝના ચેરમેન શ્રી રામભાઈ મોકરીયાનો આજે પહેલી જૂને કપમો જન્મદિવસ

હોય તો શું થઈ શકે? એનું જીવંત ઉદાહરણ છે ભારતભરની જાણીતી મારૂતિ કુરિયરના સ્થાપક શ્રી રામભાઈ મોકરીયા. જિંદગીમાં વર્ષો ઉમેરાતા જાય એ સાહજિક પ્રક્રિયા છે. રામભાઈ મોકરીયા એવા વ્યક્તિ છે જેમણે વર્ષોમાં જિંદગી ઉમેરી છે. સદા ઉત્સાહ, ઉત્કર્ષથી એમની બોડીલેંગ્વેજ છલકાય અને એટલે જૂ જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યાં હોવા છતાં એમને ચહેરા પર કે કામમાં ક્યાંય થાક વર્તાતો નથી.

વ્યાપારિક જવાબદારીઓથી પણ સવિશેષ તેઓ સામાજિક અને રાષ્ટીય સેવાર્થે ખૂબ જ પ્રતિબદ્ધ છે. વર્તમાન કોરોના મહામારીના કપરા સમયમાં

ઉજજેનમાં પશુપાલકોના

વિવાદમાં યુવકની હત્યા થઈ

ગોવિંદને ઈજાગ્રસ્ત હાલતમાં

જિલ્લા હોસ્પિટલમાં દાખલ

કરવામાં આવ્યા હતો. અહીં તબીયત

બગડ્યા પછી ગોવિંદને ઇન્દોર

રિફર કરવામાં આવ્યો. પરંતુ,

શનિવારે સવારે ગોવિંદનું મોત

નીપજ્યું હતું. જોકે તેની સાથે થયેલા

હુમલાનો અને હત્યાનો વીડિયો

વાયરલ થયો હતો. વીડિયોના

આધારે પોલીસ આરોપીની શોધ

કરી રહી છે. ગોવિંદના મિત્ર સૂરજે

જણાવ્યું હતું કે, સંત બાલીનાથનગરના ગોવિંદ લખવાલ

અને લવકુશનગરના આશુ ડાગર

પશુ પાલન કરે છે. પશુપાલન મુદ્દે તેમની વચ્ચે વિવાદી હતો. આ

દરમિયાન શુક્રવારે આશુ ડાગર

ગોવિંદને તેના ઘરે લઈ ગયો હતો.

તેના ઘરે તેના સાથીદાર લાલા ભાટ,

વિશાલ ભાટ, સાગર ભાટ, દીપક

અને ભય્યુ હથિયાર સાથે તૈયાર બેઠા

હતા. ગોવિંદ તેના મિત્ર સૂરજ સાથે

આશુના ઘરે પહોંચ્યા ત્યાં તરત જ

આરોપીઓ બંને પર તૂટી પડ્યા.

એવું કહેવામાં આવે છે કે, સૂરજ તો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હારા

સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાશે

ઓક્સિજન લેવલ વધારવા માટે

યોગ, યોગની સાથે કોરોના સામે

લડત જેવા અનેક જીવનદાયી

મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

યોગ જાગૃતતા અંગેનું અભિયાન

પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે

મેડીકલ સાયન્સએ પણ સ્વીકારી

લીધુ છે કે યોગ એ માત્ર શારીરીક

સમાધાન યોગથી શક્ય બન્યું છે,

જૂન થી ૨૧ જૂન સુધીનું યોગ ચલાવી રહ્યુ છે. ગુજરાત ભરમાથી કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય

થાય અને યોગ થકી લોકોના વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા

માનસિક સ્વાસ્થ્ય અને શારિરિક વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું

આજે સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે

અમદાવાદ, સ્વસ્થ રાખવા માટે યોગ, માટેનું માધ્યમ યોગ છે.તો આવો

હુમલા કર્યો હતો. આ વીડિયો જીવ બચાવી ભાગી છૂટ્યો, પરંતુ વાયરલ થયો. ત્યારબાદ શુક્રવારે ગોવિંદને આરોપીઓએ ઘેરી લીધો

સર્વિસીઝ દ્વારા માનનીય વડાપ્રધાનાન

પીએમ કેર્સ ફડમાં રૂ. ૧,૦૮,૦૦,૦૦૦ (રૂપિયા એક કરોડ આઠ લાખ) અર્પણ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી રાહત કંડમાં પણ રૂ. ૧૦,૮૦,૦૦૦ (રૂપિયા દસ લાખ એસી હજાર) અર્પણ ક્યાં છે. તેમની કર્મનિષ્ઠાથી પ્રેરાઈને શ્રી મારૂતિ કુરિયરના કર્મયોગીઓએ પણ રાષ્ટ્રીય યોગદાન તરીકે દૂરેક સ્ટાફના એક દિવસના પગારની કુલ રકમ રૂ. ૮,૧૦,૦૦૦ (રૂપિયા આઠ લાખે દસ હજાર) પીએમ કેર્સ કંડમાં જુમા કરાવી છે. આમ, શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પરિવાર દ્વારા કુલ રૂ. ૧,૨૬,૯૦,૦૦૦ (રૂપિયા એક કરોડ છવ્લીસ લાખ નેવું હજાર) દેશની સેવા માટે અર્પણ કરેલા છે. રામભાઈ મોકરીયાએ પોતાના

જુન્મદિનની ઊજવણીના ભાગરૂપે વીમા સુરક્ષા આપવા જઈ રહ્યા છે. અચાનક સર્જાતા અકસ્માતથી પરિવારના મોભી અથવા કમાનાર मुप्य व्यक्तिनुं निधन थाय त्यारे પરિવારના અન્ય સભ્યો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે, તેથી આવા કુટુંબીને મદદરૂપ થવા માટે પોરબંદર જિલ્લામાં અંદાજે ૯૦,૦૦૦ પરિવારોને પરિવારદીઠ

એક વ્યક્તિનો અકસ્માત વીમો-

પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ

આવરી લઈને તેમના વીમાનું

હતો. ગોવિંદને બધાએ ઘેરી

લોખંડના સળીયા અને ચપ્પાથી

મારી અધમૂરો કરી દીધો હતો.

ગોવિંદે પણ પોતાનો જીવ બચાવવા

માટે આરોપીઓના હાથ અને પગ

જોડ્યા, પરંતુ આરોપીના માથા પર

ખૂન સવાર હતુ, તેમને જરા પણ દયા ન આવી.. તે નિર્દયતાથી મારતા

જ રહ્યા. જેમ-તેમ આશુના ઘરેથી

નીકળી ગોવિંદ બહાર આવી રસ્તા

પર પડ્યો તો આરોપીઓ ત્યાં પણ

પહોંચી ગયા. આશુએ ગોવિંદને

પકડી રાખ્યો અને સાગર ભાટ તેને

લાકડીથી ખરાબ રીતે મારતો રહે છે.

ગોવિંદની હાલત મરવા જેવી થઈ

ગઈ તો, વિશાલ બાટ મોટરસાઈકલ

લઈને આવ્યો. તેના પર ગોવિંદને

બેસાડી ઘરની સામે ફેંકી ગયા.

ઘરની બહાર ઇજાગ્રસ્ત ગોવિંદની

હાલત જોઈ પરિવારજનો તેને

હોસ્પિટલમાં લઈ ગયા હતા.

બાદમાં ઇન્દોરની એમવાય

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો,

પરંતુ ગોવિંદનો જીવ બચાવી શકાર્યો નહીં. ધોળે દિવસે ગોવિંદને માર

આપણે સૌ યોગ સાથે જોડાઇયે અને

યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ

સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે

છે. જે થકી ગુજરાત રાજય યોગ

બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોંચ નીમી, તેમજ

યોગ કોચને તાલીમ આપી

તાલીમબધ્ધ યોગ કોચ બનાવવા.

અને દરેક યોગ કોચ હેઠળ ૧૦૦

જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા.આ

યોગ ટ્રેનરો દ્રારા યોગ વર્ગો તેમના

વિસ્તારમાં યોગ બોર્ડ અંતર્ગત શરૂ

"યોગને છેવાડાના માનવી

કરીએ.

જીવનમા સારૂ સ્વાસ્થ્ય, સફળતા કરાવવાની કામગીરી સદરહું બોર્ડ

અને સંપુર્ણ સુખોને પ્રાપ્ત કરવા દ્રારા કરવામાં આવે છે.

પ્રિમિયમ ભરી આપવામાં આવશે.

રેસ દરમિયાન દુર્ઘટનામાં ૧૯ વર્ષના રાઇડરનું દુખદ મોત

ઈટલી. મોટો ગ્રાંપી રેસ દરમિયાન એક અન્ય બાઇકથી જોરદાર ટક્કર થયા બાદ સ્વિત્ઝરલેન્ડના યુવા રાઇડર જેસન ડુપાસ્ક્રિયરનું મોત થયું છે. તે માત્ર ૧૯ વર્ષના હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેઓ જિંદગીની જંગ હારી ગયા. મોટો ગ્રાંપીએ ટ્વીટર પર લખ્યું કે મોટો ૩ ક્વાલિફાઇંગ બીજા સેશનમાં ગંભીર ઘટના બાદ અમે દુઃખી છીએ કે અમે જેસન ડુપાસ્કિયરને ગુમાવી દીધો છે. સમગ્ર મોટો ગ્રાંપી પરિવાર તરફથી અમે તેમની ટીમ, તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે

મોટો ગ્રાંપીએ વધુમાં લખ્યું કે, જેસન તમે ખૂબ યાદ આવશો. બીજી તરફ, કેરેગી હૉસ્પિટલે કહ્યું છે કે એફઆઇએમ મેડિકલ ઇન્ટરવેન્શન વાહન સાઇટ પર તાત્કાલિક પહોંચી ગયું હતું. એર

અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ

લિક્ટ કરીને હૉસ્પિટલ લઇ જતાં પહેલા ટ્રેક ખાતે જ તેમની તપાસ કરવામાં આવી હતી.મેડિકલ સ્ટાફે તેમને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા. ડુપાસ્કિયરની મોટો ૩માં આ માત્ર ત્રીજી સીઝન હતી. તેઓ रेस दरिभयान ट्रेड पर अन्य બાઇકર સાથે ટકરોઇ ગયા અને ઉછળીને ઘણે દૂર પટકાયા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

થયા હતા. ગ્રાંપી રેસના વિજેતા ફ્રાન્સના ફૈબિયો બન્યા. જોકે સાથી રાઇડરને ગુમાવવાના કારણે આ જીત બાદ તેંઓ ઘણા ઇમોશનલ થઈ ગયા. સ્વિત્ઝરલેન્ડનો ઝંડો લહેરાવતા એક દર્શકે તેમને ઝંડો તેમને આપ્યો અને જેસનને શ્રદ્ધાંજલિ આપતાં પોતાના દેશનો ઝંડો લહેરાવવાના બદલે સ્વિત્ઝરલેન્ડનો ઝંડો

ડુપ્લાસ્કિયરની ટીમ પ્રુએસ્ટલે આ ઘટના બાદ રેસથી પોતાને અલગ કરી દીધી.

શેર ઈન્ડિયા સિક્યુરિટીઝ દ્વારા ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે નોંધપાત્ર આંકડાઓ નોંધાવ્યા

ભારતના અગ્રણા ટેક આધારિત નાણાકીય સમૂહમાંથી એક શેર ઈન્ડિયા સિક્યુરિટીઝ લિમિટેડ દ્વારા મંગળવાર, ૨૫મી મે, ૨૦૨૧ના રોજ ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષાંત માટે મજબૂત નાણાકીય પરિણામોની ઘોષણા કરવામાં આવી છે.

શેર ઈન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે ૨૫.૩ની ઈપીએસ સાથે રૂ. ૮૦.૭ કરોડનો આજ સુધીનો તેનો સૌથી વધુ વેરા પછીનો નફો નોંધાવ્યો છે. વેરા પછીના નફાનું માર્જિન ૧૮ ટકાએ સ્થિર રહ્યું છે. રૂ. ૦.૫નું આખરી ડિવિડેડ જાહેર કર્યું છે, જેને લઇ આખા વર્ષનું ડિવિડંડ રૂ. ૨ સુધી પહોંચશે.

એસઆઈએસએલ એન એસઈમાં ૭ ટકાના શેર ઓફ ઓપ્શન પ્રીમિયમ ટર્નઓવર અને ૩ ટકાના ભાવિ ટર્નઓવર સાથે ભારતીય ડેરિવેટિવ બજારમાં મુખ્ય ખેલાડી છે. એસઆઈએસએેલે છેલ્લાં થોડાં વર્ષોમાં એનબીએફસી. ઈન્શ્યુરન્સ બ્રોકિંગ અને વેલ્થ મેનેજમેન્ટમાં ડાઈવર્સિફાઈ કર્યું છે. શેર ઈન્ડિયા ટેકનોલોજીની વાત આવે ત્યારે અવ્વલ રહી છે અને એકધારી નવીનતા અને આરએન્ડડીને લીધે તેનો હિસ્સો જાળવી રાખ્યું છે. આ બધાં મંચો મશીન લર્નિંગ અભિમુખ છે અને ઈન-હાઉસ ટેકનોલોજી પર આધારિત છે. સફળ પરિણામો પર બોલતાં એસઆઈએસએલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કમલેશ વાડીલાલ શાહે જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ ૨૦૨૧ પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ, ટોટલ સિક્ચુરિટીઝ લિમિટેડના હસ્તાંતરણ પછી કામગીરીમાં ઉછાળો, બીએસઈ ઉપરાંત એનએસઈના મુખ્ય બોર્ડ પર લિસ્ટિંગ, ટોટલ કોમોડિટીઝ લિમિટેડનું હસ્તાંતરણ, સિંગાપોરમાં ડબ્લ્યુ.ઓ.એસ. થકી દરિયાપારની બજારોમાં કામગીરીનું વિસ્તરણ વગેરે સહિત ઘણી બધી રીતે શેર ઈન્ડિયા માટે સીમાચિહનરૂપ વર્ષ રહ્યું હતું.નાણાકીય કામગીરીના હિસ્સા વિશેઃ અમે અવિસ્મરણીય વર્ષ નોંધાવ્યું છું, જ્યાં અમારી મહેસૂલ અને નકો ગૃત વર્ષની

તુલનામાં ૧૦૦ ટકાથી વધ્યા છે.

અમે ઉદ્યોગમાં ભાવિ દઢીકરણ માટે

ઉત્તમ સ્થાનબદ્ધ છીએ અને

બજારમાં આગેવાની જાળવી રાખી

નાણાં વિભાગમાં ઓછી બુધ્ધિના માણસો છે:ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનો બફાટ (એજન્સી) નવીદિલ્હી,

અત્યંત પ્રતિભાશાળી હોવાની સાથે સાથે અર્ણધાર્યુ વર્તન કરવા પંકાયેલા ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં જ એક અમેરીકન ચેનલના પત્રકારને ઈન્ટરવ્યુ આપતા જણાવ્યુ હતુ કે ભારતના નાણાં વિભાગમાં ઓછી બુધ્ધીના માણસો કામ કરે છે. હુ મિત્ર છું એટલેૃ જાણું

ઈન્ટરવ્યુ લેનાર પત્રકારે જણાવ્યુ હતુ કે તમને ભારત સરકારમાં નાણાં મંત્રી તેમને ભારત સરકારમાં નાણામંત્રી બનાવી દેવામાં આવે તો? જવાબમાં સ્વામીએ કહ્યુ હતુ કે હું નાણામંત્રી હોઉ તો સ્થિત સુધારવા હાથ ધરી છે. માંગ ઉભી કરવા પ્રયાસ કરૂ. એ માટે દશના નાગરીકોના ખિસ્સામાંથી નાણાં મુકવા પડે. નગરીકોને સીધી આર્થિક મદદ કરવી પડે.

Growing Brain



ડો. સ્મૃતિ પટેલ એમ.બી.બી.એસ. એમ.ડી. પીડીયાટ્રીક્સ પીડીયાટ્રીક ન્યુરોલોજીસ્ટ (CMC, VELLORE)

હવેથી પીડીયાટ્રીક ન્યુરોલોજીસ્ટ આણંદ શહેરમાં ઉપલબ્ધ <u>हर शनिवारे</u>

ફું તમારુ બાળક/કિશોર...
ં બેસવા, ચાલવા, બોલવા અને સમજવામાં મોડુ છે ?
- વારંવાર, લાંબી, તાવ સાથે /વગર ખેંચ/વાઈની તકલીક ધરાઈ રહ્યો છે ?
- અસમાન્ય વર્તાશું કે અથવા ચંચળતા ધરાઈ રહ્યો છે ?
- વારંવાર, બોલવા છતા ધ્યાન ન આપવુ અને એક ને એક વાતનું અનુકરણ કરે છે ?
- વારંવાર માથાના દુખાવાની તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે ?
- ચાલવામાં અસંતુલન ધરાઈ રહ્યો છે ? ચાલવામાં અસંતુલન ધરાઈ રહ્યો છે શે સામાર્ય કહે રહ્યું છે જો હા તો આપે તાત્કાલિક પીડીયાટ્રીક ન્યુરોલોજસ્ટનો સંપર્ધ કરવો જોઈએ

નીચે દર્શાવેલ રોગોની સારવાર હવે શક્ય છે તમારા શહેરમાં... વાઈ/ખેંચની તકલીફ, આદાશીશી/માથાનો દુખાવા, સેરીબ્રલ પાલ્સી, જી.બી.એસ (નસોની તકલીફ), ડેવેલેપમેટસ ડીલે, ઓટીઝમ/એ.ડી.એચ.ડી. , લકવો, સ્નાયુની તકલીફ, મગજનો તાવ, મગજની ગાંઠ

ઉપલબ્ધ સેવાઓ મગજની પટ્ટી, નસ અને સ્નાયુની તપાસ, બહેરાશની તપાસ સમયઃ શનિવાર (૧૦ થી ૧)

+696626698868, +692862244363 પરીમલ હેલ્થ કેર, નયાપડકાર પ્રેસની બાજુમાં, સ્ટેશન રોડ, આણંદ, -૩૮૮૦૦

SAKAR HEALTHCARE LIMITED

[CIN: L24231GJ2004PLC043861]

Reg. Office: Block No.10-13, Village: Changodar, Sarkhej-Bavla Highway, Tal: Sanand, Dist: Ahmedabad – 382 213 Phone: 02717-250477 Fax: 02717-251621 Email: info@sakarhealthcare.com Web: www.sakarhealthcare.com

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/ YEAR ENDED ON 31ST MARCH, 2021

Rs. In Lakh					
		Standalone	Consolidated		
PARTICULARS	Quarter ended on 31-03-2021	Year ended on 31-03-2021	Quarter ended on 31-03-2020	Quarter ended on 31-03-2021	Year ended on 31-03-2021
	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)
Total income from operations (Net)	2,168.15	9,473.93	1,826.04	2,168.15	9,473.93
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	223.61	1,324.22	307.44	222.66	1,323.27
Net Profit for the period before tax					
(after Exceptional and/or Extraordinary items)	223.61	1,324.22	307.44	222.66	1,323.27
Net Profit for the period after tax					
(after Exceptional and/or Extraordinary items)	174.39	1,069.20	286.17	173.43	1,068.25
Total Comprehensive Income for the period	182.19	1,073.84	281.96	181.22	1,072.89
Equity Share Capital	1,561.80	1,561.80	1,496.10	1,561.80	1,561.80
Reserves (Excluding Revaluation Reserves)	-	8,284.37	-	-	8,283.42
Earnings Per Share (after extraordinary items) (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)					
Basic:	1.17	6.88	1.88	1.17	6.87
Diluted:	1.17	6.88	1.88	1.17	6.87

The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges under

Regulation 33 of the SEBI (LODR) Reg., 2015.

The full format of Annual Financial Results are available on the website of NSE at www.nseindia.com and also on the website of the Company i.e. www.sakarhealthcare.com. Date : 31st May, 2021

ભારતમાં કોરોનાની બીજી લહેરનું ઘટતું જોર

૧૨ અઠવાડિયા પછી મૃત્યુમાં १७ टङानो घटाडो नोंधायो

કોરોનાની બીજી લહેરમાં ભારતમાં નવા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. દૈનિક કેસની સંખ્યામાં પાછલા અઠવાડિયાથી મોટો ફરક જોવા મળ્યો છે, પરંતુ મૃત્યુઆંકમાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, ૧૨ અઠવાડિયા પછી દેશમાં કોરોનાથી થતા દૈનિક મૃત્યુમાં ૧૭%નો ઘટાડો નોંધાયો છે. ૩૪ દિવસ પછી દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ૩૦૦૦ની નીચે પહોંચ્યો છે. કોરોનાની બીજી લહેરનું જોર હવે ઘટતું દેખાઈ રહ્યું છે, દેશમાં સતત ત્રણ અઠવાડિયાથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં પણ નવા કેસમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. ૨૪થી ૩૦ મે સુધીમાં દેશમાં ૧૨.૯૫ લાખ નવા કેંસ નોંધાયા છે, જેમાં પાછલા

અઠવાડિયાની સરખામણીમાં

ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવો ઘટાડો મૃત્યુઆંકમાં નથી જોવા મળી રહ્યો, દેશમાં ૨૪થી ૩૦ મે દરમિયાન ૨૪,૩૭૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, આ અગાઉના અઠવાડિયા દરમિયાન આંકડો ૨૯,૩૩૧ પર પહોંચ્યો હતો. આ પહેલા ૧૧ અઠવાડિયા સુધી કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં મૃત્યુઆંક ઊંચો

જઈ રહ્યો હતો. આ પહેલા ૧-૭ માર્ચ દરમિયાન મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો હતો. મે મહિનામાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ૧.૧૫ લાખને પાર કરી ગયો છે. જોકે, કોરોનાના લીધે દેશમાં થયેલા મૃત્યુનો આંકડો ૩૦૦૦ની નીચે પહોંચ્યો છે, આવું ૨૬ એપ્રિલ પછી પહેલીવાર થયું છે. દૂશમાં ૨૪ કલાકમાં ૨,૭૨૨ દર્દીઓના મોત નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રના જૂના

— — — **નવી દિલ્હી,** ૨૭%નો ઘટાડો નોંધાયો છે. કોરોના ઉમેરાયેલા ૪૧૨ મૃત્યુની ગણતરી જી લહે૨માં વાયરસના કેસમાં જે રીતે ઝડપથી કરવામાં નથી આવી. રાજ્યમાં પાછલા બે અઠવાડિયામાં જૂના બાકી રહેલા ૬૦૦૦ મૃત્યુ ઉમેરવામાં આવ્યા છે. આ સાર્થે દેશમાં કોરોનાના નવા ૧,૫૩,૬૬૩ નવા કેસ નોંધાયા છે, પં દિવસ પછી આટલો મોટો ઘટાડો નોંધાયો છે.

આ પહેલા ૧૦ એપ્રિલના રોજ ૧.૫૨ લાખ નવા કેસ નોંધાયા હતા. અઠવાડિયા દરમિયાન સૌથી વધુ ૨,૧૨,૦૮૩ કેસ નોંધાયા બાદ ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા દરમિયાન દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાંથી પમાં જ પાછલા ૭ દિવસની સરખામણીમાં નવા કેસમાં વધારો થયો છે. જે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સિક્કિમ, મૃશિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને લદાખનો સમાવેશ થાય છે. આ સિવાય આસામ અને ત્રિપુરામાં થયેલો ઘટાડો સામાન્ય છે.

તામિલનાડુમાં શશીકલાના રાજનીતિમાં પરત ફરવાના સંકેત

બે વર્ષ પહેલા અજ્ઞાદ્રમુક પરથી શશીકલાએ તેમની કમાને ગુમાવી હતી પરતું હવે તેમણે પોતાના સમર્થકોને જમાવ્યું છે કે એક સારો નિર્ણય લેવામાં આવશે. તેમની આ ટીપ્પણીથી તે પાર્ટી પર ફરીવાર નિયંત્રણ કરવાના પ્રયત્ન અને રાજનીતિમાં પરત ફરવાના સ્પષ્ટ

શશીકલાએ છ એપ્રિલના રોજ તામિલનાડુ વિધાનસભા ચૂંટણીના પહેલા જાહેરાત કરી હતી કે તે રાજનીતિથી દૂર રહેશે. હવે તેમણે કહ્યું છે કે પાર્ટીને આંતરકલેહના લીધે બરબાદ થતાં જોઇ શકતી નથી.

સાફ શબ્દોમાં કોઇ ઉલ્લેખ ના કર્યો પરતું તેમણે પાર્ટીના બે મુખ્ય નેતાઓ પલાનીસ્વામી અને પનીરસેલ્વમ ના મતભેદ વિશે જ ટીપપણી કરી હોવાનું માનવામાં આવી રહ્યુંછે.

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતાના વિશ્વાસપાત્ર શશિકલાએ ફોન પર તેમના બે વફાદાર નેતાઓ સાથે ફોનની વાતચીતમાં આ વાત સામે આવી છે. પહેલી ઓડિયો કલીપમાં સંભળાય છે કે આપણે પાર્ટીને વ્યવસ્થિત કરી લઇશું. હું આવીશ.અને બીજી ઓડિયો કલીપમાં પોતાના

તેમણે પાર્ટીના નૃત્તવના મામલે ભલે સમર્થકો ને કહે છે કે પાર્ટીના નેતાઓની કડી મહેનત એમાં સામેલ છે. તેમને લડતા જોઇને દુખ થાય છે. તે મૂક દર્શક બનીને તે આ જોઇ શકતી નેથી. શશીકલાએ જણાવ્યં હતું કે કોરોના વાયરસની બીજી લહેર ઓછી થતાં જ તેઓ સમર્થકોને મળશે. તેમૂણે કહ્યું કે ટૂંક સમયમાં જ સારો નિર્ણય લેવામાં આવશે. ૨૦૧૭ માં, અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ શશીકલાને જેલમાં મોકલવામાં આવ્યા હતા .જેથી તેમણે અને તેમના ભત્રીજા દિનાકરણ બે વર્ષ પહેલાં પાર્ટી પર પકડ ગુમાવી દીધી

કેશોદના અખોદરમાં બંધ મકાનમાંથી ૫૦ હજારની ચોરી

જૂનાગઢ : કેશોદ તાલુકાના અખોદર્ ગામમાં રહેતા કારાભાઈ રૂડાભાઈ કાથડના બંધ મેકાનના તાળા તોડી કોઈ અજાણ્યા શખસો ઘરમાં ઘુસી ગયા હતા. ઘરમાં રહેલી લોખંડની પેટી તોડી તેમાં રાખેલા રૂપિયા ૫૦ હજાર ચોરી ગયાની ફરિયાદ થતા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ

ડીમાન્ડ નોદીસ સિક્જારિટાઇઝેશન એન્ડ રિકસ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોસંમેન્ટ સિક્જુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્જુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોસંમેન્ટ) રુલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અથિનિયમની કલમ ૧૩ (૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓનો પર્યાગમાં આ નિયામોના નિયમ ૩ ની સાથે વાંચતા, આઇઆઇએકએક પ્રકૃ કાઇનાન્સ વિચિત્ર (IFL HFL) (અગાઉ ઈન્ડિયા ઈન્ડિયા ઇન્કોલાઇન હાર્ડિસેંગ કાઇનાન્સ લિમિટેડ)ના અધિકૃત અધિકારીએ જારી કર્યા છે. ઉપરાંત્રત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગણી નોટિસ, ઉપાર લેનારા (ઓ) ને, તેઓને સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ ૨કમ પરત કરવા માટે હાકલ કરે છે. ઉપરના સંબંધમાં, ફરીથી આ સુચનાપ્રકાશિત થયાની તારીખશી ૯ 0 દિવસની અંદર લેલદાર (ઓ)ને યુક્તથી કરવા માટે સુચના આપવામાં આવે છે, ના વધુ વાળ સાથે, નીચે જણાવેલ ૨કમ, ઓ માંગણી સુચના યુક્ત્રણીની તારીખ સુધી લેલદાર (ઓ) ની લગત, તારીખ મુજબની ૨કમ માંગની સુચના અને લોનની ૨કમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છે: -સિક્ચોર્ડ એસેટ (સ્થાઇ મિલ્કત)નં વર્ણન

બીપીનભાઇ શ્રીમાળી, મતી હિનાબેન શ્રીમાળી સ્પોક્ટ નં.૯૦૦૯૪૧)	૨૯-મે-૨૦૨૧ રૂા.૮,૨૧,७૯૪/- (રૂપિયા આઠ લાખ એક્વીસ હજાર સાતસો ચોરાણું ફક્ત)	પ્રોપર્ટી નં.પ૩૦, એરીયાનું માપ ૯૮૦ સ્કે.ફીટ., મોહનપુર, તલોદ, પીનકોડ: ૩૮૩૩૧૦, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત			
મતી. રેખાબેન પટેલ, અશ્વીનભાઇ પટેલ સપેક્ટ નં.૮૯૩૨૯૦ અને ૯૩ ૦ ૦)	રહ-મે-૨૦૨૧ (પ્રોસપેક્ટ નં.૮૯૩૨૯૦ ફા.વ.૯૨,૨૪૬.૦૦)- (રૂપિયાએક લાખ વ્યાસી હજાર બસો છેતાલીસ કંકન) તેને (પ્રોસપેક નં. ૮૧૯૩૭૭ ગ્રા.૭,૭૯,૪૪૮.૦૦)- (રૂપિયા સાત લાખ અગણ્યા એસી હજાર ચારસો અડતાલીસ કંકત)	એપાર્ટમેન્ટ, બળીયાદેવ મંદિરની પાસે, કેનાલ રોડ, વટવા, અમદાવાદ. ગજરાત. ૩૮૨૪૪૦ ખાતે આવેલી મિલકત			

i આ દેવાદાર ઉપરોક્ત IIFL, HFLને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો IIFL, HFL આ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ ઉપરોક્ત સિક્યોર્ડ એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપણે તે દેવાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતો માટે અધિકૃત અધિકારીશ્રીની **હાંચ ઓક્સિ**ઃ આઈઆઈએકએલ એચએકએલ અમદાવાદ કોમર્સ હાઉસ, ચોથો માળ, કોમર્સ હાઉસ ૪, શેલ પેટ્રોલ પંપ, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ - ૩૮૦૦૫૧ અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લી., શોપ નં. ૨ અને ૩, કુમાર હાઉસ, દુર્ગા મીલ ક્રમ્પાઉન્ડ, કુમાર ઈલેક્ટ્રીક શોરૂમ પાસે, હિંમતનગર-૩૮૩૦૦૧/ અથવા **કોર્પોરેટ ઓફિસ**ઃ આઇઓઇએકએલ ટાવર પ્લોટ નં.૯૮, ફેસ-૪, ઉદ્યોગ વિહાર, ગુરંગાંવ હરીયાણા સંપર્ક કરવો.

nn

AHMEDABAD MUNICIPAL CORPORATION MAHANAGAR SEVA SADAN WATER OPERATION (E. & M.) DEPARTMENT

Tender For O & M with comprehensive repairing of all Elect. And Mech. Equipment and cleaning works of 16 Nos. Water Distribution station with labour and material of North+East+South Zone of AMC for different period.

Tender For Maintenance, Servicing and comprehensive repairing of Chlorination system with connection, disconnection and transportation of chlorine cylinder at 16 Nos. Water Distribution station of North+East+South Zone of AMC for different period.

Last Date of On-line Tender Submission	Date :- 22.06.2021 upto 18:00 Hrs.
Last Date of Tender Submission	Date :- 23.06.2021 upto 16:00 Hrs.
Date of Tender Opening	Date :- 23.06.2021 upto 17:00 Hrs.
Details and Tender available on	"www.amc.nprocure.com"

UNICK FIX-A-FORM & PRINTERS LTD.

CIN: L25200GJ1993PLCO19158

THE QUARTER AND FINANCIAL YEAR ENDED 31 ST MARCH,2021 (Rs. in Lacs)

E-mail: info@unickfix-a-form.com PH NO. +91 9978931303/04/05 Regd. Office: Block No.472, Tajpur Road, Changodar, Tal: Sanand, Ahmedabad-382213 **EXTRACT OF THE STANDALONE AUDITED RESULTS FOR**

SR. NO	PARTICULARS .	QUARTER ENDED 31.3.2021	QUARTER ENDED 31.3.2020	QUARTER ENDED 31.12.2020	YEAR ENDED 31.3.2021	YEAR ENDED 31.3.2020
INO	PARTICULARS	Audited	Audited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations (Net)	1392.94	1107.09	1322.66	5601.53	4841.21
2	Net Profit / (Loss) for the period before					
	tax and Exceptional items	56.40	32.23	14.71	310.00	394.63
3	Net Profit / (Loss) for the period before					
	tax and after Exceptional items	56.40	32.23	14.71	310.00	394.63
4	Net Profit for the period after Tax	42.31	16.83	11.03	232.51	288.63
	(after Extraordinary Items)					
5	Total Comprehensive					
	Income for the period	0.00	0.00	0.00	0.00	0.00
6	Equity Share Capital	548.50	548.50	548.50	548.50	548.50
7	Reserves(Excluding Revaluation					
	Reserves as at balance sheet date	0.00	0.00	0.00	1922.32	1689.81
8	Earning per Share-Basic					
	(after extraordinary items)					
	(of Rs. 10/- each)	0.77	0.31	0.20	4.24	5.26
	Earning per Share-Diluted					
	(after extraordinary items)	0.77	0.31	0.20	4.24	5.26
	(of Rs. 10/- each)					

(1). The above result is an extract of the detailed format of financial results for the quarter and year ended 31st March 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulation 2015. The full format of the Quarterly and yearly Financial Result as on 31st March 2021 is available on company website.

The above audited Financial results for the quarter and year ended 31st March 2021 were reviewed by the Audit committee at their meeting held on 31st May 2021 and approved by the Board of Directors at their meeting held on 31st May,2021.

The figures of the quarter ended 31st March 2021 and 31st March 2020 are the balancing figures between audited figures in respect of the full financial year and the published unaudited year to date figures upto fourth quarter of the respective financial years. Also the figures upto the end of the third Quarter were only reviewed and not subjected to audit.

> BY ORDER OF THE BOARD FOR UNICK FIX-A-FORM & PRINTERS LTD Sd/- BhupenNavnit Vasa

WHOLETIME DIRECTOR DIN: 00150717 Date: 31.05.2021

For SAKAR HEALTHCARE LIMITED Sd/- SANJAY S. SHAH MANAGING DIRECTOR Place: Ahmedabad (DIN: 01515296)

S-ટેન્ડર/2021-2022/02 (ઈએલ) તા.25 05-2021. ટેન્ડર નં. ડીઆરએમ/આરજેટી **ઈએલ**/2021-2022/02 (1) **કામનું નામ** રાજકોટ : ડિવિઝનલ ઓફિસ ખાતે AC ચેમ્બર / બોફિસોમાં ઓક્યુપેન્સી સેન્સર ની જોગવાઈ. (2) કામની અંદાજીત કિંમતઃ ₹ 22,28,010/- (4) ઓન લાઈન અરજી કરવાની તારીખ અને સમય u.24-06-2021 ના 15:00 કલાક સુધી **ઓફીસનું સરનામુઃ** ડિવિઝનલ રેલવે મેનેજ ઈલેક્ટ્રીકલ), પશ્ચિમ રેલવે, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ-360 001. વેબસાઈટ વિગત:

www.ireps.gov.in अभने साध्य हरोः **f** facebook.com/WesternRlv